

ઓનલાઇન ફોર્મ ભરવાની પદ્ધતિ

- વર્ષ:૨૦૧૨ થી ૨૦૧૫ દરમિયાન ધોરણ-૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ એન.એમ.એમ.એસ. પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીની બેંક ખાતાની વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ <http://gujarat-education.gov.in/seb> પર ભરવાની થાય છે.
- પરીક્ષા માટેના આવેદનપત્રો ભરતી વખતે આ વિદ્યાર્થીઓ ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય, ધોરણ-૮ ની મૂળ શાળા દ્વારા આ માહિતી ભરાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
- આ માટે રાજ્ય કક્ષાએ એક અલગ પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેના પર આ વિદ્યાર્થીઓની માહિતી ભરી તેની હાર્ડકોપી રાજ્ય પરીક્ષા બોર્ડ સુધી પોંચાડવાની થશે.

❖ ઓનલાઇન ફોર્મ ભરવાની પદ્ધતિ:

- ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ <http://gujarat-education.gov.in/seb> પર આપેલ “૨૦૧૨ થી ૨૦૧૫ ની બેંક ખાતાની વિગતો” વિકલ્પ પર ક્લિક કરવું.
- ત્યારબાદ વિદ્યાર્થીનું પરીક્ષા વર્ષ,રોલ નંબર તથા જન્મ તારીખ નાખી સબમીટ બટન પર ક્લિક કરવું.
- સબમીટ બટન પર ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર વિદ્યાર્થીની માહિતી ભરવા માટેનું ફોર્મ ખુલશે.
- આ માહિતીમાં વિભાગ-A માં વિદ્યાર્થીના પરીક્ષાના આવેદનપત્ર ભરતી વખતે ભરેલ માહિતી હશે. જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થઇ શકશે નહિ.
- વિભાગ-B માં વિદ્યાર્થીની ધોરણ-૯ ની વિગતો ભરવાની રહેશે. (વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૫ સુધીના વિદ્યાર્થીઓ માટે આ માહિતી ખુલશે)
- વિભાગ-C માં વિદ્યાર્થીની ધોરણ-૧૦ ની વિગતો ભરવાની રહેશે. (વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૪ સુધીના વિદ્યાર્થીઓ માટે આ માહિતી ખુલશે)
- વિભાગ-D માં વિદ્યાર્થીની ધોરણ-૧૧ ની વિગતો ભરવાની રહેશે. (વર્ષ-૨૦૧૨ અને ૨૦૧૩ ના વિદ્યાર્થીઓ માટે આ માહિતી ખુલશે)
- વિભાગ-E માં વિદ્યાર્થીની ધોરણ-૧૨ ની વિગતો ભરવાની રહેશે. (વર્ષ-૨૦૧૨ વિદ્યાર્થીઓ માટે આ માહિતી ખુલશે)
- આ માહિતી ભર્યા બાદ વિભાગ-F વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે. વિદ્યાર્થીના આધારનંબરનું તેના બેંક ખાતા સાથે સીડીંગ કરાવવું ફરજિયાત છે.
- આ માહિતી ભર્યા બાદ વિભાગ-G વિદ્યાર્થીની બેંક ખાતાની વિગતો ભરવાની રહેશે. બેંક ખાતાની વિગતો ખુબ જ કાળજીપૂર્વક ભરવી. બેંક ખાતાની વિગતોમાં ક્ષતિ થશે તો તેવા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ જમા થઇ શકશે નહિ.
- ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાથી તમામ માહિતી સેવ થશે અને પ્રિન્ટ બટન પર ક્લિક કરી ફોર્મની હાર્ડકોપી મેળવી લેવાની રહેશે.
- ફોર્મની હાર્ડકોપી પર સહિ સિક્કા કરી તે હાર્ડકોપી ટાઇમલાઇનમાં જણાવ્યા મુજબ સમયમર્યાદામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરીમાં જમા કરવવાની રહેશે.

❖ ટાઇમલાઇન

ક્રમ	વિગત	તારીખ
૧	નોડલ ઓફીસર (NSP 2.0)નો રાજ્ય કક્ષાનો માર્ગદર્શન વર્કશોપ	૨૯/૦૮/૨૦૧૬
૨	રા.પ.બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૫ ની વિદ્યાર્થી યાદી તમામ જિ.પ્રા.શિ.અ.શ્રી દ્વારા નિમાયેલ નોડલ ઓફીસર (NSP 2.0)ને ઇ-મેલથી મોકલવાની તારીખ	૨૯/૦૮/૨૦૧૬
૩	નોડલ ઓફીસર (NSP 2.0)એ વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૫ ની વિદ્યાર્થી યાદી તથા ઓનલાઇન માહિતી ભરવાની પદ્ધતિ અને ટાઇમલાઇન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરીને મોકલવાની અંતિમ તારીખ	૩૧/૦૮/૨૦૧૬
૪	તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરીએ વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૫ ની વિદ્યાર્થી યાદી તથા ઓનલાઇન માહિતી ભરવાની પદ્ધતિ અને ટાઇમલાઇન શાળાને મોકલવાની અંતિમ તારીખ	૦૩/૦૯/૨૦૧૬
૫	શાળાએ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ http://gujarat-education.gov.in/seb પર આપેલ લીંક પર વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૫માં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓની માહિતી ભરવાનો સમયગાળો	૦૬/૦૯/૨૦૧૬ થી ૧૭/૦૯/૨૦૧૬
૬	શાળા દ્વારા ભરાવામાં આવેલ ફોર્મની હાર્ડકોપી સહિ-સિક્કા કરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરીમાં જમા કરવવાની અંતિમ તારીખ	૧૯/૦૯/૨૦૧૬
૭	તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરીમાં આવેલ ફોર્મની હાર્ડકોપી જિલ્લા નોડલ ઓફીસરને જમા કરવવાની અંતિમ તારીખ	૨૧/૦૯/૨૦૧૬
૮	જિલ્લા નોડલ ઓફીસર પાસે આવેલ ફોર્મની હાર્ડકોપી રાજ્ય પરીક્ષા બોર્ડમાં જમા કરવવાની અંતિમ તારીખ	૨૩/૦૯/૨૦૧૬